



કેન્દ્રીય નાણામંત્રીશ્રીની અધ્યક્ષતામાં ન્યુદિલ્હી ખાતે યુનિયન
બજેટ ૨૦૨૪ અંગે સુચનો-અભિપ્રાયો જાણવા માટે મહત્વની
મિટીંગ યોજવામાં આવેલ...

આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના
પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા ટ્રેઝરરશ્રી વિનોદભાઈ
કાછડીયા ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-
ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ...



RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY

કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિથારામનજીની અધ્યક્ષતામાં ન્યુ દિલ્હી ખાતે તા.૨૧-૬-૨૦૨૪ ના રોજ યુનિયન બજેટ ૨૦૨૪ અંગે સુચનો-અભિપ્રાયો જાણવા માટે એક મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પ્રથમવાર માત્ર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને આ મિટીંગમાં ઉપસ્થિત રહેવા અને પ્રશ્નો-સુચનો રજુ કરવા માટે આમંત્રણ આપેલ હતું. આ મિટીંગમાં ૧૪ રાજ્યોમાંથી વિવિધ ચેમ્બરોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ અને ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયા ખાસ ઉપસ્થિત રહીને રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અને તેના યોગ્ય નિરાકરણ લવવા તેમજ આગામી યુનિયન બજેટ ૨૦૨૪ માં રાજકોટ ચેમ્બરના નીચે મુજબના વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરવા ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ.

(૧) ઇન્કમેટેક્સ એક્ટ ૧૯૬૧ ના સેક્શન 43B(h) ના અમલવારી અંતર્ગત પેમેન્ટની ચુકવણી માટે ૪૫ દિવસની સમય મર્યાદા નક્કિ કરવામાં આવેલ છે. આ સેક્શનમાંથી નિકાસકારોને મુક્તિ આપવી. કારણ કે નાના નિકાસકારો ખાસ કરીને MSME હેઠળ આવતા ઉત્પાદન કરીને નિકાસ કરનાર એકમોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. નિકાસકારોનો સમગ્ર વ્યવહાર પ્રક્રિયા તેના સલંગન ડોક્યુમેન્ટ્સ અને લેટર ઓફ ક્રેડીટ મુજબ ૧૨૦ દિવસસુધીની હોય છે. તેથી નિકાસકારો માટે આ ૪૫ દિવસની સમય મર્યાદા અનુરૂપ ન હોવાના કારણે તેઓને સેક્શન 43B(h) માંથી મુક્તિ આપવી.

(૨) ઇન્કમેટેક્સ એક્ટ ૧૯૬૧ હેઠળ તમામ કંપનીઓ જેવી કે, પ્રાઇવેટ લીમીટેડ, લીમીટેડ, સ્મોલ / પ્રોપ્રાઇટરી / પાર્ટનરશીપ ફર્મ અને એલએલપી માટેનો ટેક્સ બેનીફીટનો સ્લેબ સમાન રાખી આવા એકમોને Minimum Alternate Tax ("MAT") ની અમલવારીમાંથી બાકાત રાખવા.

(૩) પ્રમાણિક કરદાતાઓને યોગ્ય રિવોર્ડ અને ઇન્સેન્ટીવ આપવા જોઈએ. જેથી કરીને અન્ય કરદાતાઓ નિયમસર ટેક્સ ભરવા માટે પ્રેરણા મેળવે તથા ટેક્સ માળખું અને વહીવટી વ્યવસાયિક રોકાણ માટેના નિર્ણયો પર મહત્વપૂર્ણ પ્રભાવ પડશે.

(૪) ઇન્કમેટેક્સ એક્ટ ૧૯૬૧ માં જુની અને નવી બે સ્કીમો પ્રસ્થાપીત છે. તેથી માત્ર નવી સ્કીમને જ અમલીકૃત કરી, આ સ્કીમમાં હોમ લોન, તેના ઉપરનું વ્યાજ તથા લોન ચુકવણીના લાભોનો સમાવેશ કરવો. આ પ્રકારના લાભો મળવાથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના "ઘરના ઘર" નું સપનું સાકાર થાય અને દરેકને પોતાનું ઘર પ્રાપ્ત થાય.





RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY

(પ) હાલના ઈન્કમેટેક્સ સ્લેબમાં નીચે મુજબ ફેરફાર કરવા.

રૂ. ૧૦ લાખ સુધી - NIL

રૂ. ૧૦ લાખ થી રૂ. ૧૫ લાખ સુધી - ૫%

રૂ. ૧૫ લાખ થી રૂ. ૨૦ લાખ સુધી - ૧૦%

રૂ. ૨૦ લાખ થી રૂ. ૨૫ લાખ સુધી - ૧૫%

રૂ. ૨૫ લાખ થી રૂ. ૩૦ લાખ સુધી - ૨૦%

જો આ મુજબ સ્લેબ રેસીયો કરવામાં આવે તો ઈન્કમેટેક્સની આવકમાં ઘટાડાને બદલે વધારો થશે અને ઘણા નવા કરદાતાઓ વધશે.

(દ) કેન્દ્ર લેવલે તથા રાજ્ય લેવલે કાયમી જીએસટી સંકલન સમિતિની રચના કરવી. જેમાં કેન્દ્ર લેવલે નાણામંત્રીશ્રી તથા રાજ્ય લેવલે જે તે રાજ્યના નાણામંત્રીશ્રીની અધ્યક્ષતા રહેશે. આ સંકલન સમિતિમાં લીડીંગ ચેમ્બરો / એસોસિએશનો નો સમાવેશ કરવો. આ જીએસટી કાઉન્સિલની મિટીંગ દર ૩ મહિને મળતી હોય, આ સંકલન સમિતિની મિટીંગ દર દોઢ મહિને બોલાવવી. જેથી દરેક રાજ્ય લેવલના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ ત્યારે જ થઈ શકે. જેથી કરીને ૭૦% જેટલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી શકાય અને જીએસટી કાયદાને અમલીકરણ કરવામાં સરળીકરણ કરી શકાય.

(૭) તમામ પેટ્રોલીયમ પ્રોડક્ટસ અને નેચરલ ગેસને જીએસટી અંતર્ગત સમાવેશ કરવો.

(૮) જીએસટી અમલીકરણ થયા બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સમયગાળા દરમિયાન જીએસટી કાઉન્સિલ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવેલ હતા. આવા વારંવાર ફેરફારોને કારણે તે સમયગાળા દરમિયાન કરદાતાઓ સપ્લાય દ્વારા ફાઈલ કરાયેલ રીટર્નના સંદર્ભમાં ITC નો લાભ મેળવી શક્યા નથી. જેથી સરકારશ્રીને અનુરોધ કરવામાં આવે છે કે ફક્ત આટલા સમયગાળાની જ પડતર સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે OTS (One Time Settlement Scheme) અમલમાં મુકવી. આ સ્કીમ અમલમાં મુકવાથી કરદાતાઓના અનેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે. તેમજ સરકારશ્રીના કામના ભારણમાં ઘટાડો થશે અને વાસ્તવીક કરદાતાઓને યોગ્ય ન્યાય મળશે.

(૯) સોના અને ચાંદી પરનો હાલનો ૩% જીએસટી દર ઘટાડીને ૨% કરવો. અગાઉ આના પર વેટનો



RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY

દર ૧% હતો. તો હલોનો ૨% દર કરવાથી આમ જનતા ૧૦૦% બીલીંગ તરફ વળશે અને દાણચોરી જેવા દુષણો ઉપર કન્ટ્રોલ થશે.

(૧૦) ૫% જીએસટીના સ્લેબમાં સમાવિષ્ટ તમામ આઈટમો યથાવત રાખવી.

(૧૧) જીએસટી અંતર્ગત ૧૨% દર ધરાવતી આઈટમોમાંથી મેરીટના આધારે ઘણી આઈટમોને ૧૨% ના બદલે ૫% ના દરમાં સમાવિષ્ટ કરવી.

(૧૨) ૧૨% અને ૧૮% ના ટેક્સદરમાં સમાવિષ્ટ તમામ આઈટમોને કલબ કરી બે ને બદલે એક જ જીએસટી દર નવો ૧૪% કરી. આ દર તમામ આઈટમોને લાગુ પાડવો.

(૧૩) ૨૮% ના જીએસટી દર હેઠળ સમાવિષ્ટ તમામ આઈટમો યથાવત રાખવી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉપરોક્ત વિવિધ પ્રશ્નો-સુચનોની કરાયેલ રજુઆત અંગે કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિથારામનજીએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

